



I B Patel English School (Primary)

2020 – 21

Class 9

EXERCISE

Subject - GUJARATI

Chapter 1 : છપ્પા

Q 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.

1. એક મૂરખને કેવી ટેવ છે?

(A) દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.

(B) તુલસીના પાન તોડે છે.

(C) જ્યાં પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.

(D) ઉપરના તમામ

2. અખો ઈશ્વર અંગે માને છે કે...

(A) ઈશ્વર ઘણા બધા છે.

(B) ઈશ્વર એકથી વધારે છે.

(C) ઈશ્વર એક અને માત્ર એક છે.

(D) ઈશ્વર જેવું કશું નથી.

3. સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે?

(A) જ્ઞાની

(B) ધુવડ

(C) કબૂતર

(D) ડાહ્યા માણસ

4. જ્યાં જોઈએ ત્યાં બધે જ શું દેખાય છે?

(A) કૂડ કૂડ (કપટ)

(B) નિખાલસતા

(C) પ્રકાશ

(D) ડહાપણ

5. મૂર્ખ કઈ વસ્તુને ત્યજીને પથ્થરને ઉપાડે છે?

(A) ધુવડ

(B) તુલસી

(C) હીરો

(D) પાણી

Q 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

1. અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે?

Ans: ઘણા લોકો એક જ ઈશ્વરને બદલે ઘણા બધા ઈશ્વર સમજી બાહ્ય આચારમાં રચ્યા પચ્યા રહે છે. આ વાતને અખો મોટો ઉત્પાત ગણાવે છે.

2. સૂર્યની વાત કરનારને ધુવડ શો જવાબ આપે છે?

Ans: સૂર્યની વાત કરનારનો વિરોધ કરવા પોતાની ચાંચ આગળ ધરી ધુવડ તેને કહે છે કે, અમારા તો હજારો વર્ષ અંધારામાં જ ગયા છે. અમે તો સૂર્ય કદી દીઠો નથી. તમે આવા ડાહ્યા ક્યાંથી થઈ ગયા? (શું તમે અમારા કરતાં વધુ જાણો છો?)

Q 3. નીચેના પ્રશ્નોના છ સાત વાક્યોમાં ઉત્તર લખો.

1. અખાના છપ્પામાંથી તમને શું શીખવા મળે છે?

Ans : અખાના પહેલા છપ્પામાં બાહ્ય આચારમાં માનનારા અને ઈશ્વરને ન ઓળખનારા લોકો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. અખો તેમને 'મૂરખ' તરીકે સંબોધે છે.

બીજા છપ્પામાં પોતાની જાતને જ્ઞાની અને માનવંત ગણાવતા કહેવાતા મોટા અને રૂઢીચુસ્ત લોકોને ધુવડ સાથે સરખાવી નવો વિચાર ન સ્વીકારવાના તેમના સ્વભાવ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. એ દ્વારા અખો આપણને શીખવાડે છે કે આપણે હમેશા જ્ઞાન મેળવવા માટે ખુલ્લા દિલના બનવું જોઈએ. અને ઈશ્વર બાહ્ય આચારથી મળતો નથી, પરંતુ સાફ દિલ તથા માનવતા રાખીને મેળવી શકાય છે.

2. જ્ઞાની હોવાનો દેખાવ કરનારા અજ્ઞાનીઓ વિષે અખાના વિચારો વર્ણવો.

Ans : અખાના મતે જ્ઞાની હોવાનો દેખાવ કરનારા અજ્ઞાનીઓ ધુવડ જેવા હોય છે. તેઓ સૂર્યના અસ્તિત્વનો સ્વીકાર કરી શકતા નથી. એટલે કે નવા વિચારને સ્વીકારી શકતા નથી. પોતાની વર્ષો જૂની રૂઢીમાં કેદ થઈને અજ્ઞાનના અંધકારમાં પોતાનું જીવન વિતાવે છે. તેઓ હીરાનું મહત્વ સમજી શકતા નથી અને પથ્થરને કીમતી ગણે છે. જે કોઈ નવી વાત રજૂ કરે તેનો તેઓ વિરોધ કરે છે અને "તમે આવા ડાહ્યા ક્યાંથી થઈ ગયા?" એમ કહી ઉતારી પાડે છે.

Dear Students, please write all these exercises in your notebooks.